

ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડની સુવિધા માટે નિવાસીઓ માટે ઉદ્દારીકરણ

21 મે, 2003

ભારતીય નિવાસીઓ ભારતમાં માન્યતા પ્રાપ્ત ડિલર્સ કે વિદેશની બેંકમાં ફોરેન કરન્સી એકાઉન્ટ રાખી શકે તે માટે ઉદ્દારીકરણનું પગલું લેવામાં આવ્યું છે. ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન્સ મુજબ આવું ખાતું ધરાવતી વ્યક્તિને ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ ઓવરસિઝ બેંક કે પ્રતિષ્ઠિત અજન્સીઝ આપી શકે છે. કાર્ડ સામેના ખર્ચની ચૂકવણી ભારત કે વિદેશના ખાતામાંથી થઈ શકે. કાર્ડ ધારકે વિદેશમાં પોતાના એકાઉન્ટમાંથી અથવા ભારતમાંથી કોઈ તેના ખાતામાંથી નાણાં મોકલાવે તે રીતે કાર્ડનો ચાર્જ ચૂકવી શકે છે. ભારતમાં માત્ર તે ચાલુ કે બચત ખાતામાંથી નાણાં મેળવી શકે. આ માટે સીધો વહીવટ કરવાનો રહેશે, ત્રીજી પાર્ટી તેમાં સામેલ થઈ શકે નહીં.

એ પણ સ્પષ્ટ કરવામાં આવે છે કે ક્રેડિટની મર્યાદા જે તે કાર્ડ આપતી બેંક નક્કી કરે છે. આ સુવિધા અંતર્ગત રિઝર્વ બેંકે કોઈ ચોક્કસ રકમની મર્યાદા નિર્ધારિત કરી નથી.

અહીં એ પણ ચોખવટ કરવામાં આવે છે કે ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ (આઈસીસીએસ) કાર્ડ ધારક પ્રતિબંધિત વસ્તુ કે પ્રવૃત્તિ માટે કાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં જેમ કે, લોટરીની ટિકિટ, પ્રતિબંધિત મેગેઝીન કે વસ્તુઓ ખરીદવા કે કોલ બેંક સર્વિસના પેમેન્ટ વગેરે માટે કાર્ડનો ઉપયોગ થઈ શકશે નહીં.

અલ્પના કિલ્લાવાલા
મહા પ્રબંધક

પ્રેસ રિલીઝ : 2002-2003/1181